

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

:- અખબારી યાદી:-

શહેરના વિવિધ બ્રિજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ચાલુ કામ તેમજ રામ-સીતા-લક્ષ્મણ આવાસ યોજનાની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનરશ્રી

બ્રિજના અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ચાલુ કામને ઝડપથી પૂર્ણ કરવા સુચના:
સંપૂર્ણ કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનરશ્રી

તારીખ: ૦૧-૦૪-૨૦૨૧



રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા અને સુંદર શહેર રળિયામણું શહેરની ઓળખ પામેલ રાજકોટને ટ્રાફિક મુક્ત કરવા શહેરમાં હાલ બ્રિજના કામો પુરજોશમાં ચાલી રહ્યા છે. વધુમાં શહેરની પાણીની સમસ્યાના નિવારણ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પણ ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ ચાલુ બ્રિજના કામ તેમજ ચાલુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો ચાલી રહ્યા જેની આજે તા. ૦૧-૦૪-

૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલએ રૂબરૂ મુલાકાત કરી ચાલુ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને કામગીરીની સમીક્ષા કરી પ્રોગ્રેસ રીપોર્ટ મેળવ્યા હતા.

આજે સવારથી જ મ્યુનિ. કમિશનરશ્રી લક્ષ્મીનગર બ્રિજ, નાનામવા બ્રિજ, સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજની ચાલુ કામગીરીની, રૈયાધાર અને જેટકો ચોકડી ખાતે બનનાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ચાલુ કામગીરીની અને રામ-સીતા-લક્ષ્મણ આવાસ યોજનાની રૂબરૂ મુલાકાત કરી હતી. રામ-સીતા-લક્ષ્મણ આવાસ યોજના ખાતે લોકોની પાણીના કનેક્શનની માંગણી અનુસંધાને મ્યુનિ. કમિશનરશ્રીએ વિઝીટ કરી હતી.

આજે કરવામાં આવેલ વિવિધ સ્થળોની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી સાથે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી બી. જી. પ્રજાપતિ, શ્રી એ. આર. સિંહ અને શ્રી ચેતન નંદાણી, પી. એ. (ટેક.) ટુ કમિશનર શ્રી આર. આર. રૈયાણી, ગાર્ડન એન્ડ પાર્કસના ડાયરેક્ટરશ્રી ડો. કે. ડી. હાપલીયા, પર્યાવરણ ઇજનેરશ્રી નીલેશ પરમાર, એડી. સિટી. એન્જી. શ્રી એમ. આર. કામલીયા, સિટી એન્જી. શ્રી કે. એસ. ગોહેલ, શ્રી એચ. યુ. દોઢિયા, શ્રી એચ. એમ. કોટક, આસી. મેનેજરશ્રી કૌશિક ઉનાવા, ડી.ઇ.ઇ. શ્રી હિતેશ ટોળીયા, શ્રી હરેશ સોંદરવા હાજર રહ્યા હતા.

(જન સંપર્ક અધિકારી)
રાજકોટ મહાનગરપાલિકા